

દાવો રજુ તા. ૨૪/૦૩/૨૦૧૫

દાવો દા. તા. ૨૪/૦૩/૨૦૧૫

દાવો ફેસલ તા. ૧૭/૦૧/૨૦૧૮

સમય ગાળો. ૦૨ વર્ષ ૦૮ માસ ૨૪ દિવસ

મહે. વ્યારાના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં, મુ. વ્યારા

સ્પે. દિ. મુ. નં. ૧૦/૨૦૧૫

આંક-૫૨

વાદી: ધી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, ઉકાઈ શાખા, મોજે-ઉકાઈ, તા. સોનગઢ, જિ. તાપી.

વિરુદ્ધ

- પ્રતિવાદી: (૧) અંબિકા જનરલ સ્ટોર્સના પ્રોપરાઈટરપ, શ્રી હસમુખલાલ છોટાલાલ બ્રહ્મભટ્ટ. ઉ. વ. આ. ૫૬, ઘંઘો-વેપાર રહે. ગેટ પાસે, જી.એસ.સી.એલ. કોલોનીના ગેટ પાસે, ઉકાઈ, તા. સોનગઢ, જિ. તાપી.
- (૨) શ્રીમતી અતુલાબેન હસમુખલાલ બ્રહ્મભટ્ટ. (જામીનદાર) ઉ. વ. આ. ૫૨, ઘંઘો-વેપાર, રહે. ગેટ પાસે, જી.એસ.સી.એલ. કોલોનીના ગેટ પાસે, ઉકાઈ, તા. સોનગઢ, જિ. તાપી.

વાદી તરફે: વિ. વ. શ્રી કે. એસ. પ્રધાન.

પ્રતિવાદીઓ તરફે: વિ. વ. શ્રી એન. કે. દેસાઈ.

દાવો : રૂ. ૫,૪૮,૨૦૮/- ચઢતા વ્યાજ સહિત વસુલ લેવા માટેનો.

જજમેન્ટ

(૧) વાદીના દાવાની ટુંકમાં હકીકત નીચે મુજબ છે.

આ કામના વાદી ધી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા કે જેની મુખ્ય કચેરી ભદ્ર, અમદાવાદ ખાતે આવેલી છે અને જેની અધિકૃત શાખા પૈકી એક શાખા મોજે ઉકાઈ તા. સોનગઢ, જિ. તાપી ખાતે આવેલી છે. આ કામના વાદી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા " કેશ ક્રેડીટ સ્ટોકસ (એસ.બી.એફ)" કે જે ગ્રાહકોને ચોક્કસ સમય માટે ચોક્કસ નાના વેપાર કરવાના હેતુ માટે ચોક્કસ સમયમાં નક્કી કરેલા વ્યાજ સાથે ભરપાઈ કરવાની શરતે આપવામાં આવતી ધંધો ઉદ્યોગ કરવા લોન આપે છે. વાદીના શાખા મેનેજર તરીકે શ્રી સુરેશકુમાર શિવરામ નાગર નાઓ છે. તેમણે આ દાવાના કામે સહી કરેલ છે. આ કામના પ્રતિવાદી નં. ૧ નાઓને વાદી બેન્કે પોતાને ધંધો ઉદ્યોગ કરવા માટે લોનની જરૂર હોય તા. ૨૧/૧૧/૨૦૦૭ ના રોજ રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- નુ ધીરાણ મેળવેલ. આ કામના વાદીની બેન્કે પ્રતિવાદી નં. ૧ નાઓએ લોન માટે ઉપરોક્ત ધીરાણના નાણાની સલામતી માટે ગેરંટી ખતમાં સહી કરી છે. આમ પ્રતિવાદીઓએ બેન્કના રૂણનો સ્વીકાર કરેલો છે. આ કામના પ્રતિવાદી નં. ૧ નાઓએ બેન્ક પાસેથી ધીરાણ મેળવવા માટે જરૂરી કરાર તથા જામીનગીરી કરેલ તેમજ અન્ય જરૂરી લખાણ કરેલ. જે તા. ૨૧/૧૧/૨૦૧૭ ના રોજ લખી આપેલ છે. પ્રતિવાદી નં. ૧ નાઓએ વાદી બેન્ક પાસેથી ઉપરોક્ત ધીરાણ મેળવ્યા બાદ તે ધીરાણના નાણા તેઓની કેશ ક્રેડીટ ખાતામાં નિયમીત રીતે ચુકવવાના હતા. ધીરાણ મેળવ્યા બાદ પ્રતિવાદી નં. ૧ એ સદર ધીરાણના નાણા કે વખતો વખતની વ્યાજની રકમ વાદી બેન્કને ચુકવી આપી નથી. પ્રતિવાદી નં. ૧ નાઓએ વાદી બેન્ક પાસેથી મેળવેલ ઉપરોક્ત ધીરાણના નાણા પૈકી તેમણે જમા આપેલ રકમ મજરે ગણતા નીચે મુજબની રકમ વાદી બેન્કની પ્રતિવાદીઓ પાસેથી બાકી પડે છે.

માંગણાની વિગત

રૂ. ૨,૮૮,૮૪૬/- લોન ધીરાણના ખાતાની રૂએ બાકી રકમ. તા. ૩૧/૦૧/૨૦૧૫ સુધીના.

+રૂ. ૨,૪૮,૩૬૩/- વ્યાજની તથા પેનલ્ટીની રકમ તા. ૩૧/૧/૨૦૧૫ સુધી.

રૂ. ૫,૪૮,૨૦૯/- કુલ બાકી.

આમ, પ્રતિવાદીઓએ લીધેલ લોન પૈકીની ધીરાણના ખાતાની રૂએ બાકી રકમ રૂ. ૨,૮૮,૮૪૬/- તથા તા.૩૧/૦૧/૨૦૧૫ સુધી ચઢેલ વ્યાજ તથા પેનલ્ટીની રકમ રૂ. ૨,૪૮,૩૬૩/- મળી કુલ રૂ. ૫,૪૮,૨૦૯/- ની રકમની બાકી નીકળતા નાણાની માંગણી કરવા છતાં પ્રતિવાદીએ વાદી બેન્કને ખોટા ખોટા વાયદા કરી સદર ધીરાણના નાણા શરત પ્રમાણે ચુકવી ન આપી વાદી બેન્કને સાથે થયેલા કરારોનો ભંગ કરેલ છે. વાદીની બેન્કે પ્રતિવાદીઓને લેખીત નોટીસ આપી વાદીની બેન્કની ધીરાણની રકમ તથા વ્યાજ મળીને ચઢી ગયેલ કુલ રકમ ચુકવી આપવા જણાવેલ. છતાં પણ પ્રતિવાદીએ સદરહુ રકમ ના ચુકવી આપતાં હાલનો દાવો કરવાનું કારણ ઉપસ્થિત થયેલ છે. સદરહુ દાવાના કામે વાદીએ દાવાની અરજીના પેરા ૧૨ માં જણાવ્યા મુજબ દાદ માગેલ છે.

(૨) સદરહુ દાવા અરજી આવતાં આ કોર્ટે આ કામના પ્રતિવાદીને સમન્સની બજવાણી કરેલ. જે સમન્સ બજી જતાં આ કામના પ્રતિવાદી નં. ૧ નાએ આંક-૦૬ થી અરજી આપી વકીલ રોકી જવાબ રજુ કરવા મુદતની માંગણી કરેલ. ત્યારબાદ પ્રતિવાદી નં. ૧ હાજર રહેલ નથી કે કોઈ જવાબ રજુ કરેલ નથી. જેથી મારા અગાઉના ન્યાયાધીશશ્રીએ તા. ૦૩/૧૦/૨૦૧૫ ના રોજ પ્રતિવાદીનો જવાબનો હકક બંધ કરેલ છે. તેમજ પ્રતિવાદી નં. ૨ ના દાવાની નોટીસ આંક-૦૫ થી બજી ગયેલ. ત્યારબાદ પુરતો સમય આપવા છતાં પ્રતિવાદી નં. ૨ આ કામે જાતે કે વકીલ મારફતે હાજર રહેલ નથી. જેથી પ્રતિવાદી નં. ૨ સામે સદર દાવાની કાર્યવાહી એકતરફી ચલાવવાનો હુકમ મારા અગાઉના ન્યાયાધીશશ્રીએ તા. ૦૩/૧૦/૨૦૧૫ ના રોજ આપેલ. ત્યારબાદ આ કામે મુદદા કાઢી સદર કામ વાદીના પુરાવા માટે રાખવામા આવેલ. ત્યારબાદ પ્રતિવાદી નં. ૧ અને ૨ તરફે આંક-૧૮ થી જવાબનો હકક ખોલવાની તથા પ્રતિવાદી નં. ૨ સામે દાવો બાયપાર્ટી ચલાવવાની અરજી આવતા તે મંજુર કરવામા આવી. બાદમાં પ્રતિવાદી તરફે આ કામે આંક-૧૯ થી જવાબ રજુ કરવામા આવેલ. જેની ટુંકી હકીકત નીચે મુજબ છે.

સદર દાવા અંગે પ્રતિવાદીઓએ આંક-૧૯ થી પોતાનો જવાબ રજુ કરેલ છે. જેમાં જણાવેલ છે કે પ્રતિવાદી નં. ૧ નાએ વાદી બેન્ક પાસેથી રૂ.૩,૦૦,૦૦૦/- નું ધીરાણ લીધેલાની હકીકત સાચી છે. વધુમા પ્રતિવાદી જણાવે છે કે પ્રતિવાદી નં. ૧ નાએ હાઈપોથીકેશનનો કરાર બેન્કને લખી આપેલ હોવાની હકીકત કાયદેસર નથી. સદર પ્રતિવાદી તેનો ઈનકાર કરે છે. વધુમા પ્રતિવાદી જણાવે છે કે વાદી બેન્કને પ્રતિવાદી નં. ૧, ૨ એ જરૂરી રિવાઈવલના લખાણ કરી જરૂરી રિવાઈવલના લખાણો વાદી બેન્કને વખતો

વખત લખી આપેલ હોવાની હકીકત સાચી નથી. તેમજ ધીરાણની રકમ ઉપર ૧૨.૫ ટકા વ્યાજ આપવાની શરત થઈ હોવાની હકીકત પણ સાચી ન હોવાનું પ્રતિવાદી જણાવે છે. વધુમા પ્રતિવાદી જણાવે છે કે વાદીએ પેનલ્ટી આપવાની વાદી સાથે પ્રતિવાદીઓની કોઈ શરત થયેલ નથી. વધુમા વાદીએ સદર માંગણાની વિગતમાં પ્રતિવાદીએ વાદી બેન્કને બાકી લેણા પેટે આપેલી જમા રકમ વાદીએ દાવામાં બતાવી નથી કે જમા આપી નથી. જેથી જમા આપેલી રકમ બાદ કરવામાં આવે તો વાદીએ જે માંગણી કરી છે તેટલી માંગણીની રકમ વાદી બેન્ક માંગવા કોઈ રીતે હકકદાર નથી. વધુમા પ્રતિવાદી જણાવે છે કે તા. ૨૮/૧૧/૨૦૦૭ ના રોજ ભરેલા રૂ. ૧,૦૦,૦૦૦/- તથા તા. ૨૫/૦૨/૨૦૦૮ ના રોજ વાદી બેન્કમાં જમા કરાવેલ રૂ. ૨૦,૦૦૦/- તથા તા. ૧૫/૦૩/૨૦૦૮ ના રોજ જમા કરાવેલા રૂ. ૨૫,૦૦૦/- તથા તા. ૦૮/૧૧/૨૦૦૮ ના રોજ રૂ. ૫૩,૪૬૫.૮/- તથા તા. ૦૩/૦૩/૨૦૧૦ ના રોજ રૂ. ૧,૦૦૦/- તથા તા. ૩૦/૦૭/૨૦૧૦ ના રોજ રૂ. ૧૦,૦૦૦/- તથા તા. ૧૫/૦૮/૧૦ ના રોજ રૂ. ૨૦,૦૦૦/- અને તા. ૨૪/૧૦/૨૦૧૪ ના રોજ રૂ. ૧૮૧૧.૮૨/- મુજબનું સ્ટેટમેન્ટ હોવા છતાં બતાવ્યા નથી અને તેમ કરીને વાદીએ ખોટી રકમની માંગણી કરી ખોટો દાવો કરેલો છે. જેથી વાદીનો દાવો હાલના તબક્કે ચાલી શકે તેમ ન હોય તેવા તમામ સંજોગોમાં લેણાની રકમ તેમજ વ્યાજનું સ્વરૂપ પણ બદલાય તેમ હોય તેવા તમામ સંજોગોમાં વાદીનો દાવો રદ કરવો જોઈએ તેવી વિનંતી પ્રતિવાદી દ્વારા કરવામાં આવી છે.

- (૩) સદરહુ જવાબનો હકક બંધ કર્યા બાદ તા. ૩૦/૦૫/૨૦૧૬ ના રોજ મારા અગાઉના ન્યાયાધીશશ્રીએ આ દાવાના આખરી નિકાલ માટે આંક-૦૭ થી મુદદા કાઢેલા. જે નીચે મુજબ છે.

મુદદા:

૧. શું વાદી પુરવાર કરે છે કે પ્રતિવાદી નં. ૧ નાને ધંધો, ઉદ્યોગ કરવા માટે રૂ. ૩,૦૦,૦૦૦/- નું ધીરાણ આપવામાં આવેલ?
૨. શું વાદી પુરવાર કરે છે કે પ્રતિવાદી નં. ૧ નાને વારંવાર રૂબરૂમાં તથા લેખીતમાં જાણ કરવા છતાં ધીરાણની રકમ પરત ચુકવી આપેલ નથી?
૩. શું વાદી પુરવાર કરે છે કે પ્રતિવાદી નં. ૧ પાસે કુલ રૂ. ૫,૪૮,૨૦૮/- લેણી રકમ બાકી નીકળે છે?

૪. શુ વાદી દાવામાં માંગ્યા મુજબની દાદ મેળવવા હકકદાર છે?

૫. શુ હુકમ અને હુકમનામુ?

પ્રતિવાદી તરફે ઉપરોક્ત મુદદા કાઢ્યા બાદ આંક-૧૮ થી જવાબ રજુ કરેલ હોય તે લગત નીચે મુજબનો વધારાનો મુદદો તા. ૦૩/૧૦/૨૦૧૬ ના રોજ મારા અગાઉના ન્યાયાધીશશ્રીએ કાઢેલો છે. જે નીચે મુજબ છે.
 ૩(અ). શું પ્રતિવાદી પુરવાર કરે છે કે તેઓએ જુદી જુદી તારીખોમાં કુલ રૂ. ૨,૩૧,૨૭૭/- વાદી બેન્કમાં જમા કરાવેલ છે?

ઉપર મુજબના મુદદાના જવાબ નીચે મુજબ છે.

જવાબ:

મુદદા નં. ૧ હકારમાં.

મુદદા નં. ૨ હકારમાં.

મુદદા નં. ૩ હકારમાં.

મુદદા નં. ૩(અ) હકારમાં.

મુદદા નં. ૪ અંશતઃ હકારમાં

મુદદા નં. ૫ આખરી હુકમ મુજબ

(૪) ઉપર મુજબના મુદદાના જવાબની ચર્ચા શરૂ કરતા પહેલાં બન્ને પક્ષકારો તરફે રજુ થયેલ પુરાવા નોંધવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

વાદી તરફે મૌખિક પુરાવો.

ક્રમ	આંક	વિગત
૧	૨૮	સાહેદ ચંદુભાઈ ઉકાજીભાઈ ચૌધરીની સોગંદ પરની સરતપાસ.
૨	૪૭	વાદી તરફે સુધારેલી આંક-૨૮ ની સરતપાસ.

વાદી તરફે દસ્તાવેજી પુરાવો.

ક્રમ	આંક	વિગત	તારીખ
૧	૨૯	પ્રતિવાદીએ બેન્કને કરી આપેલ લોનના ધીરાણ માટેના અરજીપત્રકની અસલ.	૨૧/૧૧/૨૦૦૭
૨	૩૦	પ્રતિવાદી નં. ૧નાએ વાદી બેન્કને કરી આપેલ હાઈપોથીકેશન એગ્રીમેન્ટની અસલ.	
૩	૩૧	પ્રતિવાદી નં. ૨ એ વાદી બેન્કને લખી આપેલ ગેરંટી એગ્રીમેન્ટના લખાણની બેન્કના સિકકાવાળી અસલ.	
૪	૩૨	પ્રતિવાદી નં. ૧ એ વાદી બેન્કને લખી આપેલ લેટર ઓફ એરેંજમેન્ટના લખાણની બેન્કના સિકકાવાળી અસલ.	૨૧/૧૧/૨૦૦૭
૫	૩૩	પ્રતિવાદી નં. ૧ નો પર્સનલ સેગમેન્ટ એડવાન્સ બ્રીફ ઓપીનીયન રિપોર્ટના લખાણની બેન્કના સિકકાવાળી અસલ.	૨૧/૧૧/૨૦૦૭
૬	૩૪	પ્રતિવાદી નં. ૨ નો પર્સનલ સેગમેન્ટ એડવાન્સ બ્રીફ ઓપીનીયન રિપોર્ટના લખાણની બેન્કના સિકકાવાળી અસલ.	૨૧/૧૧/૨૦૦૭
૭	૩૫	પ્રતિવાદીએ વાદી બેન્કને લખી આપેલ તા. ૦૬/૦૮/૨૦૧૨ ના રિવાઈવલ લેટરની અસલ.	૦૬/૦૮/૨૦૧૨
૮	૩૬	પ્રતિવાદી નં. ૧ ના એકાઉન્ટના સ્ટેટમેન્ટની સહી સિકકાવાળી નકલ.	
૯	૪૦	વાદી તરફે પુરાવા બંધની પુરશીશ.	

પ્રતિવાદી તરફે રજૂ થયેલ મૌખિક પુરાવો:

ક્રમ	આંક	વિગત
૧	૪૩	પ્રતિવાદી હસમુખભાઈ છોટાલાલ બ્રહ્મભટ્ટની સોગંદ પરની સરતપાસ.

પ્રતિવાદી તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવો:

ક્રમ	આંક	વિગત
૧	૨૦	પ્રતિવાદી તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ.
૨	૫૦	પ્રતિવાદી તરફે પુરાવા બંધની પુરશીશ.

મુદ્દા નં. ૧:

આ કામના વાદી તરફે સાહેદ ચંદુભાઈ ઉકાજીભાઈ ચૌધરીની સોગંદ પરની સરતપાસ આંક-૨૮ થી રજુ કરેલ છે. સદરહુ જુબાનીમાં તેમણે સોગંદ પર જણાવેલ છે કે " સદરહુ કામના પ્રતિવાદી ઉપરોક્ત ઠેકાણે રહીને વ્યવસાય કરતા આવેલા છે. તેમજ તેઓની દુકાન કે જે અંબિકા જનરલ સ્ટોર્સ માટે લોનની જરૂરીયાત ઉભી થતા પ્રતિવાદી નં. ૧નાએ તા. ૨૧/૧૧/૨૦૦૭ ના રોજ રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- નુ ધીરાણ મેળવેલ છે." આ કામે વાદીએ પોતાની જુબાનીના સમર્થનમાં આંક-૨૮ થી અને આંક-૩૦ થી પ્રતિવાદીઓને વાદીની બેન્કે કરી આપેલ લોન વિષયક ધીરાણની અરજી પત્રકની અસલ રજુ કરેલ છે. તે બન્ને અરજીઓ ધ્યાને લઈએ તો ઉપર જણાવેલ હકીકતો પરથી આ કામના પ્રતિવાદી નં. ૧ અંબિકા જનરલ સ્ટોર્સના પ્રોપરાઈટર હસમુખલાલ છોટાલાલ બ્રહ્મભટ્ટ નાઓએ તેમા જણાવેલ લોન ધીરાણ મેળવેલાનુ સ્પષ્ટ થાય છે. તેમજ આ કામના પ્રતિવાદી નં. ૧ નાએ પોતાના આંક-૪૩ ની સોગંદ પરની ઉલટતપાસમા પણ એ હકીકતનો સ્વીકાર કરેલો છે કે તેઓએ વાદી બેન્ક પાસેથી ત્રણ લાખ રૂપિયાની લોન લીધેલી છે.આમ, આ કામના વાદીએ પોતાનો કેસ મૌખિક જુબાનીથી તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે સાબિત કરેલ હોવાથી મુદ્દા નં. ૧ નો જવાબ હકારમાં આપુ છું.

મુદ્દા નં. ૨:

આ કામે વાદીએ પોતાના સોગંદ પરની જુબાનીમાં જણાવેલ છે કે આ કામના પ્રતિવાદીઓએ લોન દવારા મેળવેલ ધીરાણની રકમ વખતોવખતની વ્યાજની રકમ વાદી બેન્કને ચુકવણી કરેલ નથી. તે હકીકત સાબિત કરવા માટે વાદી તરફથી પ્રતિવાદી નં. ૧ ના ખાતાનો ઉતારો રજુ કરવામાં આવેલ છે. જેમાં પ્રતિવાદી નં. ૧ ના ખાતામાં બેન્કની રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- જણાવી છે. વધુમાં આંક-૩૫ થી પ્રતિવાદીએ વાદી બેન્કને લખી આપેલ તા. ૦૬/૦૮/૨૦૧૨ ના રિવાઈવલ લેટરની અસલ આ સાથે સામેલ કરેલ છે. સદરહુ રિવાઈટલ લેટર મા પ્રતિવાદીઓ દવારા સદરહુ લોનની બાકી રકમ ભરવા સહમતી દર્શાવી છે. આમ, આ કામના વાદીએ પોતાના મૌખિક તથા લેખીત પુરાવાથી એ હકીકત સાબિત કરેલી છે કે આ કામના પ્રતિવાદીઓએ મેળવેલ લોનના ધીરાણની રકમની ચુકવણી કરેલ નથી. જેથી મુદ્દા નં. ૨ નો જવાબ હકારમાં આપુ છું.

મુદદા નં. ૩ અને મુદદા નં. ૩(એ):

આ કામે વાદી બેન્ક દ્વારા આંક-૨૯ થી આંક-૩૬ સુધીના તમામ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવે તો એક હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે આ કામના પ્રતિવાદી દ્વારા વાદી બેન્ક પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦/- ની લોન તા. ૨૧/૧૧/૨૦૦૭ ના રોજ લેવામાં આવેલ છે. જેના પર વાદીએ નાણા લીધા બાદ ધીરાણ પર ૧૨.૫૦ ટકા પ્રમાણે દર નિયમિત રીતે વ્યાજ તથા હપ્તાઓ ચુકવવાના થતા હતા અને જો પ્રતિવાદી મજકુર ઉપર પ્રમાણે નિયમિત રીતે વ્યાજ તથા હપ્તાઓ ભરવામાં કસુર કરે તો વખતો વખતની હપ્તાની રકમ તથા વ્યાજની રકમ તેના ખાતામાં વધારી તેના પર પણ વ્યાજ ચુકવવા માટે તેઓ જવાબદાર હતા અને જો વ્યાજના દરમાં બેન્કના નિયમ મુજબ ફેરફાર થાય તો તેવા ફેરફાર થયેલા વ્યાજના દર પ્રમાણે પણ વ્યાજ ચુકવવા માટે તેઓ જવાબદાર હતા. આ રીતે સ્પષ્ટ કરારો પ્રતિવાદી મજકુરે વાદી બેન્કને લખી આપી કબુલ રાખ્યા છે. આથી વાદી બેન્ક પ્રતિવાદી નં. ૧ પાસેથી લોન ધીરાણના ખાતાની રૂએ બાકી રકમ તા. ૩૧/૦૧/૨૦૧૫ સુધીના સમય સુધી તેમજ વ્યાજની તથા પેનલ્ટીની રકમ તા. ૩૧/૦૧/૨૦૧૫ સુધીની મળી કુલ રૂ. ૫,૪૮,૨૦૮/- પ્રતિવાદી પાસેથી વસુલ કરવા વાદી બેન્ક હકકદાર હોવાનું આ અદાલતનું માનવાનું થતું હોય મુદદા નં. ૩ નો જવાબ હકારમાં આપુ છું. તેમજ મુદદા નં. ૩ (એ) માટે આ કામના વાદી દ્વારા પ્રતિવાદીના બેન્ક સ્ટેટમેન્ટની નકલ આંક-૩૬ થી સામેલ કરેલ છે. જેમાં પ્રતિવાદી દ્વારા જુદી જુદી તારીખોના રોજ બેન્કમાં બાકી લેણી રકમ પૈકી થોડી થોડી રકમની ચુકવણી કરેલાનું સ્પષ્ટ થાય છે. જેમાં કુલ રૂ. ૨, ૩૧, ૨૭૭/- રૂપિયા પ્રતિવાદીએ વાદી બેન્કને ભરપાઈ કરેલાનું જણાય છે. જેથી મુદદા નં. ૩ (એ) નો જવાબ હકારમાં આપુ છું.

મુદદા નં. ૪:

આ કામે વાદીએ દાવા અરજીના પેરા ૧૨ માં એવી દાદ માગેલી છે કે વાદી બેન્કમાં પ્રતિવાદી પાસેથી નીકળતા બાકી ધિરાણના લેણા રકમ રૂ. ૫, ૪૮, ૨૦૮/- તથા તે રકમ ઉપર તા. ૩૧/૦૧/૨૦૧૫ સુધી વસુલ થતાં સુધી ચુકવવા પાત્ર વ્યાજ સહીત દાવાના ખર્ચ સહીત તમામ પ્રતિવાદીઓ પાસેથી તેમજ તેઓની વ્યક્તિગત તથા સહીયારી તમામ સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લઈ વાદીની લેણા રકમ વાદીને અપાવશો. મુદદા નં. ૧ અને મુદદા નં. ૨ ની ચર્ચાના આધારે એ હકીકત સ્પષ્ટ થાય છે કે આ કામના પ્રતિવાદીઓ વાદીના રૂ. ૫, ૪૮, ૨૦૮/- રૂપિયા ચુકવવા માટે જવાબદાર છે. આમ, વાદી ઉપર જણાવેલ રકમ પુરેપુરી વસુલાત કરાવવા હકકદાર

જણાય છે. તેમજ હાલમાં બેન્કમાં જે વ્યાજનો દર પ્રવર્તમાન છે. તે ૭ (સાત) ટકા છે. જેથી આ કામના વાદી બેન્કની રકમ વસુલ પર ૭ (સાત) ટકા વ્યાજનો દર મંજૂર કરવામાં આવે તો નાણાનું હીત સચવાશે તેવું જણાતા મુદ્દા નં. ૪ નો જવાબ અંશતઃ હકારમાં આપુ છું તથા મુદ્દા નં. ૫ નો જવાબ નીચે મુજબ આખરી હુકમ કરીને આપુ છું.

આખરી હુકમ

- (૧) વાદીનો દાવો અંશતઃ મંજૂર કરવામાં આવે છે. આ કામના પ્રતિવાદીઓ (૧) અંબિકા જનરલ સ્ટોર્સના પ્રોપરાઈટરપ, શ્રી હસમુખલાલ છોટાલાલ બ્રહ્મભટ્ટ. ઉ. વ. આ. ૫૬, ઘંધો-વેપાર, રહે. ગેટ પાસે, જી.એસ.સી.એલ. કોલોનીના ગેટ પાસે, ઉકાઈ, તા. સોનગઢ, જિ. તાપી તથા (૨) શ્રીમતી અતુલાબેન હસમુખલાલ બ્રહ્મભટ્ટ. (જામીનદાર)ઉ. વ. આ. ૫૨, ઘંધો-વેપાર, રહે. ગેટ પાસે, જી.એસ.સી.એલ. કોલોનીના ગેટ પાસે, ઉકાઈ, તા. સોનગઢ, જિ. તાપી. નાઓના નામે હુકમ કરવામાં આવે છે કે તેમણે આ કામના વાદી બેન્કને રૂ. ૫,૪૮,૨૦૮/- રૂપિયા તા.૩૧/૦૧/૨૦૧૫ થી વસુલ થતાં સુધી વાર્ષિક દર ૭ (સાત) ટકાના સાદા વ્યાજ સાથે ચુકવી આપવા.
- (૨) આ કામના પ્રતિવાદીઓએ કોસ્ટ પેટે રૂ. ૧૦૦૦/- ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટીમાં જમાં કરવાનો હુકમ કરવામાં આવે છે.
- (૪) હુકમ મુજબ હુકમનામું દોરવું.

હુકમ આજ રોજ તા. ૧૭ મી માહે જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

સ્થળ: વ્યારા
તા.૧૭/૦૧/૨૦૧૮

(સારંગ એસ કાળે)
જજકોડ જીજે૦૦૭૫૩

પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ,
તાપી, મુ. વ્યારા.